

## બનાસકાંઠા જીલ્લા પોલીસ દ્વારા કરેલ સારી કામગીરી (તા.૦૧/૦૪/૨૦૧૯ થી તા. ૦૭/૦૪/૨૦૧૯ સુધી)

(૧)

તા:-૩૧/૦૩/૨૦૧૯ ના કલાક ૨૩/૩૦ થી ૦૦/૪૫ વાગ્યા દરમ્યાન મોજે ભાભરજુના ગામે આ કામના તહેદાર(૧) ચિરાગભાઈ રમણીકલાલ જાતે પટેલ ઉ.વ. ૪૧ રહે શ્રુવત સોસાયટી દિયોદર ત્રણ રસ્તા પાસે ભાભર તા.ભાભર મુળ રહે રાજગઢી રાધનપુર તા.રાધનપુર જી.પાટણ (૨) સુરેશભાઈ ધીરજલાલ જાતે કટારીયા ઉ.વ.૫૨ રહે રાજકોટ રૈયા રોડ તિરૂપતિનગર -૩ તા.જી.રાજકોટ (૩) હિતેશભાઈ જાદવભાઈ જાતે ઠાકોર ઉ.વ.૨૬ રહે ધાંગધા રેલ્વે સ્ટેશન રોડ તા.ધાંગધા જી.સુરેન્દ્રનગર (૪) પ્રતાપસિંહ મગનસિંહ રાહોડ રહે. ભાભર જુના તા.ભાભર (૫) દિનેશ ઉર્ફે દાની દરજી રહે. મેલડી માતાના મંદીરની પાછળ ભાભર નવા તા.ભાભર (૬) જીતુભાઈ ઉર્ફે ઘાઇટો ઇશ્વરભાઈ માળી રહે. ભાભર નવા તા.ભાભર (૭) ચતુરદાસ (૮) પ્રેમજી રાજાજી ઠાકોર રહે. બલોધણ તા.ભાભર નં. ૪ પ્રતાપસિંહ મગનસિંહ રોડ રહે ભાભરજુના તા.ભાભરવાળાએ પોતાના ડેલાની બહાર ખુલ્લી જાહેર જગ્યામાં માણસો ભેગા કરી ઘાણી પાસા (ઘોડી) તથા પૈસા વડે હરજીતનો જુગાર રમી રમાડી ઘાણીપાસા નંગ-૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂ. ૪૫૬૨૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૧૦૦૦/- એમ કુલે રૂ.૪૬૬૨૦/- ના મુદામાલ સાથે તહે.નં. ૧,૨,૩ નાઓ પકડાઇ જઇ તથા તહે.નં. ૪,૫,૬,૭,૮ નાઓ નાસી જઇ ગુનો કરેલ હોઇ તેઓના વિરુદ્ધ ભાભર પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં.બં.૪૯/૨૦૧૯ જુગાર ધારા કલમ. ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૨)

તા.૩૧/૦૩/૨૦૧૯ ના કલાક- ૨૨/૪૫ વાગે મોજે નારોલી હગામી ચેક પોસ્ટ ગામે આ કામના તહેદાર રાણપુરી ભીખપુરી ગૌસ્વામી તથા જેમલભાઈ રામચંદભાઈ ઠાકોર બન્નેરહે.પાતીયાસરા તા- થરાદ વાળાઓએ એકબીજાના મેળાપીપણાથી પોતાના કબજાની ટવેરા ગાડી નં. જીજે-૧૯-એ-૭૮૮૧માં ગે.કા અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના પરપ્રાતીય દારૂ બોટલ નંગ ૨૮૮ કિ.રૂ.૨૮,૮૦૦/-નો મુદામાલ રાખી વાહન તથા મોબાઇલ સાથે કુલ કી.રૂ. ૨,૨૯,૩૦૦/- ના મુદામાલ સાથે વાહન ચેકીંગ દરમ્યાન મળી આવી ગુનો કરેલ હોઇ તેના થરાદપો.સ્ટે. પ્રોહીગુ.ર.નં-૧૬૨/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ ૬૫એઇ, ૯૮(૨),૯૯, ૧૧૬(૨),૮૧ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૩)

તા ૦૪/૦૪/૨૦૧૯ ક.૧૯/૧૫ વાગે મોજે નારોલી હગામી ચેક પોસ્ટ ગામે આ કામના ગીરધારીરામ ગોમારામ જાટ રહે.ડાબલી પોસ્ટ. પીપરાલી તા.ગુડામાલાણી જી.બાડમેર રાજસ્થાન વાળાએ પોતાની કબજાની મારુતી ઇકો ગાડી જેના ચીચીસ નંબર MA3ERLF1S00662574 માં ગે.કા અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના પરપ્રાતીય દારૂ તથા બીયર બોટલ નંગ ૧૨૦ કિ.રૂ.૨૭૦૦૦/- તથા મોબાઇલ કિ.રૂ. ૫૦૦/- તથા મારુતી ઇકો ગાડી કિં રૂ. ૪૦૦૦૦૦/- ના મુદામાલ સાથે કુલ કી.રૂ. ૪,૨૭,૫૦૦/- ના મુદામાલ સાથે વાહન ચેકીંગ દરમ્યાન મળી આવી ગુનો કરેલ હોઇ થરાદ પ્રોહી.ગુ.ર.નં.૧૬૭/૨૦૧૯ પ્રોહીએક્ટ.કલમ ૬૫એઇ, ૯૮(૨),૯૯, ૧૧૬(૨) મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.

(૪)

તા. ૦૭/૦૪/૨૦૧૯ ના કલાક ૦૨/૨૦ વાગે મોજે પાલનપુર ગોલનદાજ વાસ કાસમભાઈ અબ્દુલરહેમાન જાતે શેખના મકાનની આગળ જાહેરમાં આ કામના આરોપી નં. ૧ થી ૩ (૧) કાસમભાઈ અબ્દુલરહેમાન જાતે શેખ, રહે. પાલનપુર, ગોલનદાજ વાસ, તા. પાલનપુર તથા (૨) આસીફભાઈ સબ્બીરભાઈ જાતે મન્સુરી રહે. પાલનપુર રબારીવાસ સલેમપુરા તા. પાલનપુર તથા (૩) નાસીરભાઈ અહેમદભાઈ જાતે મેવાતી રહે. પાલનપુર, ગોલનદાજ વાસ, તા. પાલનપુર તથા (૪) નઇમ ઇબ્રાહીમભાઈ બેલીમ રહે. પાલનપુર સાતસંચા તા.પાલનપુર તથા (૫) જાવીદભાઈ કાસમભાઈ જાતે શેખ રહે. પાલનપુર, ગોલનદાજ વાસ, તા. પાલનપુર તથા (૬) સાહીદભાઈ ગફ્ફારભાઈ મેમણ રહે. પાલનપુર આંબલી પાસે નાનીબજાર તા.પાલનપુર નાઓ જાહેરમાં તીનપત્તીનો પૈસા વડે ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમી રમાડતા જુગારના સાહિત્ય સાથે મો.ફોન નંગ-૧ કિ.રૂ. ૫૦૦/- તથા રોકડ રકમ રૂ. ૧૦,૬૮૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૧૮૦/- સાથે પકડાઇ જઇ તથા આ.નં. ૪ થી ૬ નાઓ પોલીસ રેઇડ દરમ્યાન નાસી જઇ ગુનો કરેલ હોઇ તેઓના વિરુદ્ધ પા.શહેર પુર્વ પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. ૧૧૧/૨૦૧૯ જુગારધારા કલમ ૧૨ મુજબનો ગુનો દાખલ કરી સારી કામગીરી કરવામાં આવેલ છે.